



ગુજરાત જાહેર સેવા આયોગ  
આયોગની એડવોકેટ પેનલની રચના કરવા અંગેની જાહેરાત

ગુજરાત જાહેર સેવા આયોગ સામે નામદાર સુપ્રિમ કોર્ટ/નામદાર ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થયેલ/થનાર કોર્ટકેસમાં આયોગ વતી રજુઆત/બચાવ કરવા એડવોકેટ પેનલની રચના કરવામાં આવનાર છે. જે એડવોકેટશ્રીઓ આયોગની પેનલ પર રહેવા ઈચ્છુક હોય તેઓએ નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. અરજીપત્રકનો નમૂનો અને લાયકાતની વિગતો આયોગની વેબસાઈટ <https://gpsc.gujarat.gov.in> અને <https://gpsc-ojas.gujarat.gov.in> પરથી મેળવી શકાશે. અરજી પત્રકમાં જરૂરી વિગતો ભરી જરૂરી બિડાણ સહિતનાં અરજીપત્રકો સચિવશ્રી, ગુજરાત જાહેર સેવા આયોગ, છ-૩ સર્કલ પાસે, છ રોડ, સેક્ટર-૧૦/એ, ગાંધીનગર ૩૮૨૦૧૦ ને તા. ૧૫-૦૭-૨૦૧૯ સુધીમાં અચૂક મળી જાય તે રીતે મોકલી આપવા જણાવવામાં આવે છે. તા. ૨૯/૦૬/૨૦૧૯



## ગુજરાત જાહેર સેવા આયોગ

છ-૩ સર્કલ પાસે, છ રોડ, સેક્ટર-૧૦/એ, ગાંધીનગર

### આયોગની એડવોકેટ પેનલની રચના અંગેની જાહેરાત

ગુજરાત જાહેર સેવા આયોગ સામે ઉદ્ભવતા કોર્ટકેસ માટે આયોગ વતી નામદાર વડી અદાલતમાં અસરકરક રજૂઆત થઈ શકે તે હેતુથી આયોગ દ્વારા પેનલ ઓફ એડવોકેટ્સની રચના કરવામાં આવે છે. હાલની આયોગની પેનલ ઓફ એડવોકેટ્સની મુદત તા. ૩૧/૦૮/૨૦૧૯ના રોજ પૂર્ણ થાય છે. આથી વધુ ત્રણ વર્ષ માટે આયોગ દ્વારા નવી પેનલ ઓફ એડવોકેટ્સની રચના કરવાની થાય છે આથી આયોગની પેનલમાં કામ કરવાની ઈચ્છા ધરાવતા એડવોકેટશ્રીઓ પાસેથી નિયત નમૂનામાં અને નિશ્ચિત સમય મર્યાદામાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તા. ૦૧/૦૭/૨૦૧૯ થી અરજીઓ મંગાવવામાં આવે છે. સદરજુ પેનલ ઉપર રહેવા માટેની અગત્યની સૂચના/વિગત નીચે મુજબ છે.

- (૧) અરજદારે સંપૂર્ણ માહિતી સાથેનું અરજીપત્રક નિયત નમૂનામાં ભરી તા.૦૧/૦૭/૨૦૧૯ થી તા.૧૫/૦૭/૨૦૧૯ સુધીમાં આયોગને મળે તે રીતે મોકલી આપવાનું રહેશે.
- (૨) આયોગની સદરજુ પેનલમાં રહેવા માટે અરજદારે ઓછામાં ઓછા છ (૦૬) વર્ષનો સર્વિસ મેટરને લગતો નામદાર હાઈકોર્ટનો અનુભવ ધરાવતા હોવા જોઈએ.
- (૩) અરજદારે અરજીપત્રક સાથે પોતે ચલાવેલા હોય તેવા ઓછામાં ઓછા પાંચ (૦૫) કેસના રીપોર્ટ્સ ચૂકાદાની નકલ બીડવાની રહેશે.
- (૪) પેનલ નક્કી કરવા બાબતે સર્વે હક્ક આયોગને આધીન રહેશે.
- (૫) કોઈપણ સૂચના આપ્યા વિના પેનલ રદ કરવાની સત્તા આયોગની રહેશે.
- (૬) આયોગની પેનલ માટે પસંદગી પામેલ એડવોકેટશ્રીઓને ચૂકવવાની થતી ફી ના દર આયોગના વખતો વખતના નિર્ણયને આધિન સુધાર્યા મુજબના રહેશે.

અરજી કરવા બાબતે વધુ માહિતી માટે એડવોકેટની પેનલમાં રહેવા માટેના અરજી પત્રકનો નમૂનો અને અગત્યની સૂચનાઓ સાથેની જાહેરાત સેક્રેટરીશ્રી, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત હાઇકોર્ટ, રજીસ્ટ્રારશ્રી, ગુજરાત હાઇકોર્ટ તથા બાર એસોશિએશન ઓફ ગુજરાત હાઇકોર્ટ અને ગુજરાત જાહેર સેવા આયોગના નોટીસ બોર્ડ પર પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જે જોવા વિનંતી.

ખાસ નોંધ: જાહેરાતની સંપૂર્ણ માહિતી/ વિગતો જોયા બાદ અરજી કરવાની રહેશે. અરજી કર્યાની છેલ્લી તારીખ બાદ અરજી તથા અધૂરી વિગતો વાળી અરજી સ્વીકારવામાં આવશે નહિ. હાલની પેનલ પરના એડવોકેટશ્રીઓએ પણ નવેસરથી અરજી કરવાની રહેશે.

તા. ૨૯/૦૬/૨૦૧૯

અરજી પત્રકનો નમૂનો

ગુજરાત જાહેર સેવા આયોગ

એડવોકેટની પેનલમાં રહેવા માટેનું અરજી ફોર્મ

(અરજી મોકલવાની છેલ્લી તા: .....

તાજેતરનો  
પાસપોર્ટ સાઈઝનો  
ફોટોગ્રાફ

(૧) ઉમેદવારનું નામ:શ્રી/શ્રીમતી.....

(મોટા અક્ષરમાં અટક પહેલા લખવી)

(અંગ્રેજીમાં લખવું)

(અ) આપે નામ તથા અટકમાં ફેરફાર કરેલ હોય તો સરકારી ગેઝેટની નકલ બીડવી.

(૨) ઓફીસનું સરનામું.....

.....

ફોન નં..... મોબાઇલ નં.....

રહેઠાણનું સરનામું.....

.....ફોન નં.....

(૩) જન્મ તારીખ:-..... (એસ.એસ.સી.ઈ.પ્રમાણપત્ર અનુસાર)

(૪) શૈક્ષણિક લાયકાત: .....

.....

.....

.....

વિશેષ લાયકાત:.....

(૫) કાયદાની લાયકાત ધરાવનાર બાર કાઉન્સિલનો રજિસ્ટ્રેશન નં..... તા:.....

(૬) (અ) પોતે સર્વિસ મેટરના કેસ ચલાવેલ હોય તેવા ઓછામાં ઓછા પાંચ (૦૫) કેસના રીપોર્ટ્સ ચૂકાદાની નકલ સાથે બિડવી.

(બ) આપે મેળવેલ અનુભવની વિગતો: (ઓછામાં ઓછા ૭ (૦૬) વર્ષનો સર્વિસ મેટરને લગતો ગુજરાત હાઈકોર્ટનો અનુભવ)

સમય ક્યાંથી ક્યાં સુધી તારીખ	વર્ષ	માસ	દિવસ

(૭) આપ હાલમાં કેન્દ્ર સરકાર/ રાજ્ય સરકાર/ અર્ધ સરકારી/બોર્ડ નિગમોના એડવોકેટ તરીકે પેનલ ઉપર હોય તો કેન્દ્ર સરકાર/રાજ્યસરકાર/અર્ધસરકારી/બોર્ડની કચેરીનું નામ:.....  
.....

અગત્યની સુચના:

૧. આયોગ તરફથી એડવોકેટ પેનલ ઉપર નિમણૂક થયા બાદ આયોગ સામેના કોઈપણ કેસમાં વકીલશ્રી તરીકે રહી શકાશે નહીં.
૨. આ અરજી ઓછામાં ઓછા ૭ (૦૬) વર્ષનો સર્વિસ મેટરને લગતો ગુજરાત હાઈકોર્ટનો અનુભવ હોય તેવા એડવોકેટશ્રીએ કરવાને પાત્ર છે.
૩. પેનલ નક્કી કરવા બાબતે સર્વે હક્ક આયોગને રહેશે.
૪. કોઈપણ સુચના આપ્યા વગર પેનલ રદ કરવાની સત્તા આયોગની રહેશે.

ઉપરોક્ત તમામ વિગતો મેં વાંચી છે. અને તે મને મંજૂર છે. તે બાબતે અમોએ નીચે સહી કરેલ છે.

.....  
સહી

સ્થળ:

તારીખ:

નોંધ: અરજી મોકલવાનું સ્થળ:-

પ્રતિ,

સચિવશ્રી,

ગુજરાત જાહેર સેવા આયોગ

૯-૩ સર્કલ,

સેક્ટર-૧૦ “એ”, ૯ – રોડ, ગાંધીનગર-૩૮૨૦૧૦